T: +91 22 6708 2600 / 2500



08.09.2022

To

BSE Limited

Phiroze Jeejeebhoy Towers, Dalal Street,

Mumbai - 400 001.

National Stock Exchange of India Limited

Exchange Plaza, Bandra Kurla Complex,

Bandra (E),

Mumbai - 400 051.

Scrip code : 509152

Symbol: GRPLTD - Series: EQ

Dear Sir / Madam,

Subject: Compliance under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed a copy of the newspaper advertisement published on 8th September, 2022, in English language in Financial Express (all editions) and in Gujarati (Regional) language in Financial Express (Gujarat edition), informing about the transfer of equity shares of the Company to Investor Education And Protection Fund (IEPF).

Please take the above information on records.

Yours faithfully, For GRP Limited

Jyoti Sancheti

Company Secretary cum Compliance officer

Membership No. F9639



Website: www.phfleasing.com, Email id: phf_leasingltd@yahoo.co.in CORRIGENDUM NOTICE

Ref advertisement in this newspaper dated 27.8.2022 regarding the Notice of Annual General Meeting and sent to members via e-mail on 30.08.2022. With

reference to above, please note

(i) In the first para, the time may be read as 11 A.M. instead of 11 P.M. (ii) In the second para, the words "has been sent" may be read as "will be sent" and

"August 12, 2022" inadvertently mentioned may be read as "August 26, 2022".

The other details shall remain the same. This corrigendum shall be available or the website of the Company i.e. www.phfleasing.com. For PHF Leasing Limited

Shikha Kapoor Place: Jalandhar

Date: September 07, 2022

GRAVISS

GRAVISS HOSPITALITY LIMITED

Registered office: Plot No. A4 & A5, Khandala MIDC Phase II Kesurdi, Tal. Khandala, Satara, Maharashtra, 412801 Ph: 882883133 Website: www.gravissgroup.com; Email: investors.relations@gravissgroup.com;

Company Secretary, M.No. A19146

Notice of AGM

NOTICE is hereby given that the 61st Annual General Meeting (AGM) of the members of Graviss Hospitality Limited (the Company) will be held on Tuesday, September 27, 2022 at 12:30 PM (IST) through video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance with the applicable provisions of Companies Act, 2013 and the rules made thereunder, read with General Circulars dated April 08, 2020, April 13, 2020, May 05, 2020 and January 13, 2021 issued by the Ministry of Corporate Affairs (MCA Circulars) and Circular dated May 2020 and January 15, 2021 issued by the Securities and Exchange Board of India (SEBI Circular) to transact the business set out in the Notice convening the AGM.

Process of dispatch of the Notices of the AGM and the Annual Report for the financial year 2021-22 has been duly completed and sent vide electronic mode, on September 02, 2022, to the shareholders whose e-mail ids are registered with the Company/Depository Participant(s). The AGM Notice, the Annual Report and other information can also be accessed from the website of the Company at www.gravisshospitality. com/ and on the website of the stock exchange at www.bseindia.com and of Link Intime India Private Limited ("LIIPL") i.e. https://instavote. linkintime.co.in.

The Company has engaged the services of Link Intime India Private Limited (LIIPL) to provide the remote e-voting facility on InstaVote and the e-voting system on the date of the AGM on InstaMeet. Remote E-voting period starts at Saturday, 24th September, 2022 (09:00 A.M. IST) and ends at Monday, 26th September, 2022 (05:00 P.M. IST). The remote e-voting module will be disabled by Link Intime India Pvt. Ltd. for voting thereafter.

The Company has appointed Mr. Martinho Ferrao, (holding membership no. FCS 6221), Proprietor of M/s. Martinho Ferrao & Associates, Company Secretaries, to act as the Scrutinizer, to scrutinize the entire e-voting process (i.e. remote e-voting and e-voting at the AGM) in a fair and transparent manner.

The voting rights of Shareholders shall be reckoned on the paid-up value of shares registered in the name of Shareholder/Beneficial Owner as on 21st September, 2022. Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the notice and holds shares as of the cut-off date may follow the procedure for remote e-voting as enumerated in detail hereinabove. They may also refer to the FAQs and e-voting manual available at www.instavote. linkintime.co.in or write an e-mail to enotices@linkintime.co.in or investors.relations@gravissgroup.com

Members who have cast their votes by remote e-voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their vote again.

Further, as per Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we would like to inform you that the Register of Member and Share Transfer Books of the Company will remain closed from Wednesday, September 21, 2022 to Tuesday, September 27, 2022 (both days inclusive) for the purpose of the 61st AGM of the Company.

For detailed process and manner to join the AGM, please refer the AGM

In case the shareholders have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and Instavote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or write an email to enotices@linkintime.co.in or Call us : Tel : 022 - 49186000.

For Graviss Hospitality Limited

Place : Mumbai Date: September 02, 2022

Jalpa H. Salvi Company Secretary & Compliance Officer

COMFORT INTECH LIMITED CIN: L74110DD1994PLC001678

Registered Office: 106, Avkar Algani Nagar, Kalaria, Daman DD 396210; Corporate Office: A-301, Hetal Arch, Opp. Natraj Market, S. V. Road, Malad (West), Mumbai-400064.

Tel. No.: +91-22-6894-8500/08/09; Fax: +91-22-2889-2527; Email: info@comfortintech.com; Website: www.comfortintech.com.

NOTICE OF 28™ ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

In continuation of our newspaper notice published on Friday, September 02, 2022, NOTICE is hereby given that the 28th Annual General Meeting ('AGM/ the Meeting') of the Members of COMFORT INTECH LIMITED ('the Company') will be held on Thursday, September 29, 2022 at 11:00 A.M. (IST) through Video Conferencing ('VC')/ Other Audio Visual Means ('OVAM'), to transact the business as stated in the AGM Notice, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the rules made thereunder and SEBI (listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), read with the Ministry of Corporate Affairs ("MCA") circulars dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 8, 2021 December 14, 2021 and May 5, 2022 (collectively referred to as "MCA Circulars") and The Securities and Exchange, Board of India vide its Circular No. SEBI/HO/CFD/CMD 1/CIR/P/2020/79 dated May 12, 2020, SEBI/HO/CFD/ CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and SEBI/HO/CFD/ CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 (collectively referred to as "SEBI Circulars") and all other relevant circulars issued, without the physical presence of the Members at a common venue.

The Annual Report of the Company including AGM Notice for the financial year ended March 31, 2022 ("Annual Report") were sent through electronic mode only to all those members whose email id's are registered with Company or its Registrar and Share Transfer Agent or the Depositories, in accordance with the MCA circulars and the SEBI circulars and the same has been completed on Wednesday, September 07, 2022. Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. The Annual Report is also available on the Company's website at http://www.comfortintech.com/Investorrelation and on the website of the Stock Exchange i.e. BSE Limited's website at www.bseindia.com and on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdi.com (agency for providing the

Members holding shares in physical mode and/ or who have not registered/updated their email address with the Company/ its Registrar and Share Transfer Agent/ the Depositories and/ or who has acquired shares and become the members of the Company after the dispatch of notice and holding shares as of the cut-off date, i.e. September 22, 2022 can obtain Annual Report from website of Company/ Stock Exchange/ NSDL and/or login details for joining the AGM through VC/ OAVM facility including e-voting by sending scanned copy of: a) Signed request letter mentioning the folio number/ DP Id and Client Id , name and address of the member; b) Self - attested copy of PAN Card; and c) Self-attested copy address proof (eg.: Aadhar Card, Driving license, Election Identity Card, Passport) of the member by email to info@comfortintech.com, info@bigshareonline.com and evoting@nsdl.co.in and also refer to the voting instructions on the NSDL website. However, if he/ she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting vote or following the procedure as mentioned in the AGM Notice. Further, any person, who ceases to be the Member of the Company as on the cut-off date and is in receipt of this communication, shall treat the same for information purpose only.

NOTICE is also hereby given that pursuant to the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of SEBI Listing Regulations, the Company is providing a facility to the members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said meeting ("e-voting"). The Company has availed the services of NSDL to provide the facility of remote e-voting /e-voting at the AGM. Members whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting in the meeting. The voting rights of Members shall be in proportion to their shares in paid up equity capital of the Company as on cutoff date i.e.

The Remote e-voting shall commence on September, 26, 2022 at 09:00 A.M. (IST) and ends on September, 28, 2022 at 05:00 P.M. (IST). During this period shareholders of the Company, nolding shares either in physical form or in dematerialised form, as on the cut - off date i.e. September 22, 2022 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by the NSDL for voting thereafter. The facility of e-voting will also be made available at the AGM. Only those members attending the AGM through VC/OAVM, who have not cast their vote by remote e-voting and are otherwise not barred from doing so, will be able to vote at the AGM. A member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to e-vote again in the meeting.

The details instructions for joining the AGM through VC/ OAVM and casting the vote through remote e-voting/ e-voting at the AGM is provided in the Notice of the AGM. Members are requested to carefully go through the same. Members, who need assistance and/or having any grievances before or during the AGM regarding e-voting facility and/ or VC/ OAVM facility may refer to the Frequently Asked Questions (FAQs) for Members and e-voting user manual for Members available at the download section of www.evoting.nsdl.com or can send a request to Mr. Anubhav Saxena, Assistant Manager, National Securities Depository Limited, Trade World, A wing, 4th Floor, Kamala Mills Compound, Lower Parel, Mumbai - 400013 at evoting@nsdl.co.in or call on toll free no.: 1800-1020-990/1800224430 or email at info@comfortintech.com or call at Tel. No. 022-68948508/09.

Members may note that the Board of Directors at its Meeting held on May 30, 2022, has recommended a final Dividend of 5% (five per cent) of the Paid-up Equity Share Capital of the Company, i.e., Rs. 0.50/- (Fifty Paise Only) per Equity Share of Face Value of Rs. 10/- (Rupees Ten Only) each for the Financial Year ended March 31, 2022, subject to approval of the shareholders at the ensuing AGM of the Company. The Dividend, if approved at the AGM, will be paid within 30 days of the AGM. The Company has fixed Thursday, September 22, 2022 as the 'Record Date' for determining entitlement

NOTICE is also hereby given that pursuant to section 91 of the Act read with Rules made thereunder and Regulation 42 of SEBI Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, September 23, 2022 to Thursday, September 29, 2022 (both days inclusive) for the purpose of AGM and determining the entitlement of the shareholders to the Final Dividend for the Financial Year 2021-22

> BY ORDER OF THE BOARD OF DIRECTORS OF COMFORT INTECH LIMITED

NIDHI BUSA

COMPANY SECRETARY & COMPLIANCE OFFICER

DATE: SEPTEMBER 08, 2022 PLACE: MUMBAI

TV18 BROADCAST LIMITED

CIN: L74300MH2005PLC281753

Registered Office: First Floor, Empire Complex, 414 - Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013 Tel: +91 22 4001 9000 / 6666 7777 • E-mail: investors.tv18@nw18.com • Website: www.nw18.com

NOTICE FOR THE ATTENTION OF MEMBERS OF THE COMPANY 17th Annual General Meeting and Information on E-voting

Notice calling the Seventeenth (17th) Annual General Meeting ("AGM") of the Company scheduled to be held in compliance with the applicable circulars issued by the Ministry of Corporate Affairs and the Securities and Exchange Board of India through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") on Thursday, September 29 at 3:00 P.M. (IST), and the Standalone and Consolidated audited financial statements for the financial year 2021-22, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, have been sent on September 7, 2022 electronically, to the Members of the Company. The Notice of AGM and the aforesaid documents are available on the Company's website at www.nw18.com and on the website of the Stock Exchanges, i.e., BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com, respectively, and on the website of Company's Registrar and Transfer Agent, KFin Technologies Limited ("KFinTech"). at https://evoting.kfintech.com.

The documents referred to in the Notice of the AGM are available electronically for inspection by the Members from the date of circulation of the Notice of the AGM. Members seeking to inspect such documents can send an e-mail to investors.tv18@nw18.com.

Remote e-voting and e-voting during AGM:

The Company is providing to its Members facility to exercise their right to vote on resolutions proposed to be passed at AGM by electronic means ("e-voting"). Members may cast their votes remotely, on the dates mentioned herein below ("remote e-voting"). The Company has engaged the services of KFinTech as the agency to provide e-voting

Information and instructions comprising manner of voting, including voting remotely by Members holding shares in dematerialised mode, physical mode and for Members who have not registered their e-mail address has been provided in the Notice of the AGM.

The manner in which (a) persons who become Members of the Company after despatch of the Notice of the AGM and holding shares as on the Cut-off Date (mentioned herein); and (b) Members who have forgotten the User ID and Password, can obtain / generate the User ID and Password, has also been provided in the Notice of the AGM.

The remote e-voting facility will be available during the following voting period:

Commencement of : 9:00 a.m. (IST) on Sunday, September 25, 2022 remote e-voting

End of remote e-voting: 5:00 p.m. (IST) on Wednesday, September 28, 2022

The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by KFinTech upon expiry of the aforesaid period.

Members attending the AGM who have not cast vote(s) by remote

e-voting will be able to vote electronically ("Insta Poll") at the AGM.

A person, whose name is recorded in the Register of Members as on the Cut-off Date, i.e., Thursday, September 22, 2022 only shall be entitled to avail the facility of remote e-voting or for voting through

Manner of registering / updating e-mail address:

- Members holding shares in physical mode, who have not registered / updated their e-mail address with the Company, are requested to register / update their e-mail address by submitting Form ISR-1 (available on the website of the Company www.nw18.com) duly filled and signed along with requisite supporting documents to KFinTech at Selenium Tower B. Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032.
- b) Members holding shares in dematerialised mode, who have not registered / updated their e-mail address, are requested to register / update their e-mail address with the Depository Participant(s) where they maintain their demat accounts.

In case of any query pertaining to e-voting, Members may refer to the "Help" and "FAQs" sections / E-voting user manual available through a dropdown menu in the "Downloads" section of KFinTech's website for e-voting: https://evoting.kfintech.com.

Members are requested to note the following contact details for addressing queries / grievances relating to e-voting, if any:

Mr. S. P. Venugopal, Vice President,

Kfin Technologies Limited,

Selenium Tower B, Plot No.31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032

Toll-free No.:1800 309 4001 (from 9:00 a.m.(IST) to 6:00 p.m. (IST) on all working days)

E-mail: evoting.tv18@kfintech.com Joining the AGM through VC / OAVM:

Date: September 8, 2022

Members will be able to attend the AGM through VC / OAVM, through JioMeet, at https://jiomeet.jio.com/tv18broadcastagm/. The information about login credentials to be used and the steps to be followed for attending the AGM are explained in Note No. 9 of the Notice of AGM. Members who have cast their vote(s) by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote(s) again at the AGM.

> By Order of the Board of Directors For TV18 Broadcast Limited Sd/-

Ratnesh Rukhariyar Company Secretary JCK INFRA PROJECTS LIMITED CIN: U70200KA1974PLC002524

Registered office: NO 309, 1st Floor, Westminster 13, Cunningham Road, Bangalore-560 052.

Email: jckinfra@gmail.com | Website: www.jckgroup.in

NOTICE OF 46TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 46th Annual General Meeting (AGM) of the Company will be held on Thursday, 29th September 2022 at 3.00 P.M. through Video Conferencing (VC) /Other Audio Visual Means (OAVM) to transact the businesses mentioned in the AGM Notice.

In Compliance with the General Circulars dated 08.04.2020, 13.04.2020 05.05.2020, 13.01.2021 and 05.05.2022 issued by Ministry of Corporate Affairs (MCA) in view of COVID-19 pandemic and applicable provisions of the Companies Act, 2013 the Company is sending Notice of 46th AGM along with complete Annual Report by email to its Members.

The shareholders whose email Ids are not yet registered with the Company are requested to register their contact number and email id with the Company's RTA Integrated Management Services Pvt. Ltd., at giri@integratedindia.in by providing their name registered as per the records of the Company, address, contact number, email ID, PAN, DPID/Client ID or Folio Number and number of shares held by them.

The shareholders are also requested to demat their shares by contacting respective Depository Participants (DP's).

The Register of members and Share Transfer books are closed from September 19th 2022 to September 29th 2022 (both days inclusive).

The Notice calling the 46th AGM and complete Annual Report of the Company is available on website of the Company www.jckgroup.in/investors. The Company has already sent soft copy of 46th Annual Report to all shareholders whose e-mail address are available on 02.09.2022 In case of any query/grievance(s) connected with registration of email ids with

the Company for receiving AGM notice, participation and voting in the general meeting, members may contact the Company at jckinfra@gmail.com or giri@integratedindia.in. By order of the Board of Directors

> For JCK Infra Projects Limited Krishan Kapur DIN: 05183136

> > Managing Director

Place: Bengaluru Date: 07.09.2022

> COLGATE-PALMOLIVE (INDIA) LIMITED CIN: L24200MH1937PLC002700

Regd. Off: Colgate Research Centre, Main Street, Hiranandani Gardens, Powai, Mumbai 400 076. Tel: +91 22 6709 5050; Fax: +91 22 2570 5088 **Email Id:** investors_grievance@colpal.com **Website:** www.colgatepalmolive.co.in

NOTICE

NOTICE is hereby given that pursuant to Section 124(6) of the Companies Act, 2013 ("the Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") as amended to date, Colgate-Palmolive (India) Limited ("the Company") will transfer all equity shares in respect of which the dividend has not been paid or claimed by the Shareholders for seven consecutive years or more in the name of Investor Education and Protection Fund ("IEPF") Authority.

The Company has communicated individually to the concerned shareholders to claim their unpaid/ unclaimed first interim dividend amount(s) for financial year 2015-16 and failure to claim the same would lead to their equity shares being transferred to the IEPF Authority without any further notice. The details of members whose dividends have remained

unclaimed/unpaid for seven consecutive years have been hosted on the website of the Company. Shareholders are requested to refer "investor" section on the website of the Company web-link http://www.colgateinvestors.co.in/shareholder-information to verify the details of unclaimed dividends and the shares liable to be transferred to the IEPF Authority.

The concerned Shareholders may note that upon transfer of such equity shares to the IEPF Authority, no claim shall lie against the Company in respect of unpaid/unclaimed dividend amounts and the equity shares transferred to IEPF Authority. Shareholders may further note that both, the unclaimed dividends and corresponding shares including all benefits accruing on such shares, if any, once transferred to the IEPF Authority can be claimed back from the IEPF Authority for which details are available at www.iepf.gov.in

In case of any clarification/ assistance in this regard, the concerned shareholder can write to Company's Registrar and Share Transfer Agent-Link Intime India Private Limited, C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli West, Mumbai 400 083 email to iepf.shares@linkintime.co.in

All the shareholders holding shares in physical form may note that as per SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD _RTAMB/P/CIR/2021/ 655 dated 03.11.2021 it is compulsory to furnish/update PAN, KYC & Bank account details and Nomination details. Shareholders holding shares in demat mode can register/update their bank account details through their Depository Participants.

For Colgate-Palmolive (India) Limited

Surender Sharma Whole-time Director - Legal

Date: September 7, 2022

& Company Secretary



Place: Mumbai

LANCER CONTAINER LINES LIMITED

Regd. Off.: Mayuresh Chambers Premises Co-Operative Society Ltd., Unit No.H02-2, H02-3 & H02-4, Plot No.60, Sector-11, CBD Belapur, Navi Mumbai, Maharashtra, 400614 Tel no.: +022-27566940, Website: http://www.lancermarine.in

Email: info@lancermarine.in,

CIN: L74990MH2011PLC214448

NOTICE OF 11th ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC)/ OTHER AUDIO VISUAL MEANS (OAVM)

The notice is hereby given that pursuant to applicable provisions of the Companies Act, 2013 (the Act), Rules made thereunder and General Circular No. 20/2020 dated May 05, 2020 read with General Circular No. 14/2020 dated April 08, 2020 and General Circular No. 17/2020 dated April 13 2020 circular dated January 13, 2021 Circular No. 19/2021 dated 8th December, 2021 and Circular No. 02/2022 dated 05th May, 2022* (hereinafter collectively referred to as "MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI") vide Circular Nos. SEBI/HO/CFD/CMD1CIR/P/2020. 79 dated 12th May, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May, 2022, the 11th Annual General Meeting ("AGM") of the Company will be held on Friday, September 30, 2022 at 12:00 Noon. through VC OAVM, to transact the business as set out in the Notice of AGM. The Electronic copies of the Notice of the AGM and Annual Report for F.Y. 2021-22 have been sent to all the members on September 07, 2022 whose email Ids are registered with the Company / Depository Participant(s). Pursuant to Circulars mentioned above, the Company has not printed the Annual report and hence no hard copies of the Annual report will be provided.

In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, the Secretarial Standard on General Meetings ('SS-2') issued by the Institute of Company Secretaries of India and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with the MCA Circulars. the Company is providing to its Members the facility of remote e-Voting before/during the AGM and for this purpose, the Company has appointed NSDL for facilitating voting through electronic means. Members holding shares of the Company, as on the cut-off date i.e. Friday, September 23, 2022 may cast their vote electronically on the Ordinary and Special Business as set out in the Notice of AGM through electronic voting system of NSDL from a place other than venue of AGM ("remote e-voting"). All the members are informed that:

- 1) The Ordinary and the Special Business as set out in the Notice of AGM may be transacted through voting by electronic means:
- 2) The remote e-voting shall commence on Tuesday, September 27, 2022 at 9:00 A.M.
- The remote e-voting shall end on Thursday, September 29, 2022 at 05:00 P.M. The cut-off date for determining the eligibility to vote by electronic means is Friday, September 23,
- The Register of Members and Share Transfer Books of the company will remain closed from 24th September to 30th September 6) Any person, who acquires shares of the company and becomes a member of the Company after
- dispatch of the Notice of AGM and holds shares as on the cut-off date i.e. Friday, September 23, 2022 may obtain the login ID and password by sending a request at following email IDs:
- a) Secretarial@lancermarine.in b) helpdesk.evoting@nsdlindia.com , MeghaM@nsdl.co.in>
- c) prasadm@bigshareonline.com
- Members may note that: The remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting

Date: September 08, 2022

- and once the vote on a resolution is cast by the members, the members shall not be allowed to
- b) The facility for voting at the AGM shall be made available through e-voting by NSDL;
- the AGM but shall not be entitled to cast their vote again; A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote

c) Members who have already cast their votes by remote e-voting prior to the AGM may also attend

The Notice of the AGM along with instructions on e-voting is available on the Company's website http:// /www.lancermarine.in/ and also on the NSDL website www.evotingindia.com, and in case of queries, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members at the help section of www.evotingindia.com.or contact Mr. Mahendra Gupta, Company Secretary and Compliance Officer of the Company on Email id: secretarial@lancermarine.in, In case of any assistance with regards to using the technology before or during the meeting, please contact on the Helpline number + 022 - 2499 4835

This notice is also available on Company's website http://www.lancermarine.in/ and on the website of stock exchange www.bseindia.com. By order of the Board of Director

> Place: Mumbai Mahendra Gupta Dated: September 8, 2022 Company secretary Membership Number ACS No. A13010

GRP LIMITED

CIN: L25191GJ1974PLC002555

Regd. Office: Plot No.8, GIDC Estate, Ankleshwar - 393 002, Dist. Bharuch, Gujarat, India. Tel.: 02646 250471 / Website: www.grpweb.com / Email ID: investor.relations@grpweb.com

NOTICE TO SHAREHOLDERS

Shareholders are hereby informed that pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting Audit, Transfer & Refund) Rules, 2016 ("Rules") as amended, the dividend declared for the financial year 2014-15, which remained unclaimed for a period of seven years will be credited to the IEPF on 29th September, 2022. The corresponding shares on which dividends remained unpaid or unclaimed for 7 (seven) consecutive years will also be transferred as per the procedure set out in the rules.

In compliance with the Rules, Individual notices are being sent to all the concerned shareholders whose shares are liable to be transferred to IEPF as per the aforesaid Rules, the full details of such shareholders is made available on the Company's website: https://www.grpweb.com/investors

In this connection, please note the following:

- be issued and transferred to IEPF. The original share certificate(s) registered in your name(s)and held by you, will stand automatically cancelled.
- 2) In case you hold shares in electronic form: Your demat account will be debited for the shares liable for transfer to the IEPF.

In the event valid claim is not received on or before September 20, 2022, the Company will proceed to transfer the liable dividend and Equity shares in favor of IEPF authority without any further notice. Please note that no claim shall lie against the company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF pursuant to the said Rules. It may be noted that the concerned shareholders can claim the shares and dividend from the IEPF Authority by making an application in the prescribed Form IEPF-5 online and sending the physical copy of the requisite documents enumerated in the Form IEPF-5, to the Nodal officer of the Company,

For any gueries on the above matter, shareholders are requested to write to the Company at investor.relations@grpweb.com or contact Company's Registrar and Transfer Agent, Universal Capital Securities Pvt. Ltd., C 101, 247 Park, LBS Road, Vikhroli West, Mumbai-400083, email:info@unisec.in, Tel. No.: +91-22-

HARSH R. GANDHI JOINT MANAGING DIRECTOR

INSURANCE BROKERS ASSOCIATION OF INDIA CIN: U67120MH2001NPL132860

Registered Office: A-Z Industrial Premises, Co-Op Soc Ltd, 1 st floor, Unit No. 165, G. K. Marg, Lower Parel, Mumbai, 400 013,

Telephone No.24955156 Website:www.ibai.org, Email:ibai@ibai.org NOTICE

400 020, to transact the businesses as set out in the Notice convening the AGM. The Notice of AGM has been emailed to the Members on August 18, 2022 and also posted on our websitewww.ibai.org The Company has made arrangements for its members to exercise their right to vote on the resolutions set forth in the Notice of AGM by electronic voting

website of CDSLhttps://www.evotingindia.com/ The Company hereby informs that:

1. All businesses as set out in the Notice of AGM may be transacted through The remote e-voting period shall commence on Tuesday, 13" September 2022 from 09.00 a.m. and ends on Thursday, 15" September 2022 at 5.00 p.m. No Remote e-voting shall be allowed beyond the said date and time. The e-voting module shall be disabled by CDSL for voting thereafter The members of the Company, as on the cut-off date shall be entitled to cast their vote electronically according to the instructions mentioned in the AGM Notice, to obtain his/her login ID and password or visit CDSL's website

https://www.evotingindia.com/

attend the meeting but shall not be entitled to cast their vote again at the AGM. In case the members cast their vote by both the means then voting done through remote e-voting shall prevail and voting done at the AGM shall be

cut-off date i.e. Members who have paid annual membership fee as on Wednesday, August 31, 2022 only shall be entitled to cast their vote electronically

In case of any queries about e-voting, members may refer to the Frequently Ask Questions (FAQ's) and instructions made available at www.cdslindia.com or helpdesk.evoting@cdslindia.com

For INSURANCE BROKERS ASSOCIATION OF INDIA Sundaram Varadan

Director & Hon. Secretary

Reliance Retail Limited

CIN: U01100MH1999PLC120563

Regd. Office: 3rd Floor, Court House, Lokmanya Tilak Marg, Dhobi Talao, Mumbai - 400 002 Phone: +91-22-3555 3800 • E-mail: retail.secretarial@ril.com

Website: www.relianceretail.com **INFORMATION REGARDING**

TWENTY-THIRD ANNUAL GENERAL MEETING

The Twenty-third Annual General Meeting ("AGM") of the Members of the Company will be held through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") on Friday, September 30, 2022 at 11.30 a.m. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder read with all applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA"), to transact the business set out in the Notice calling the

The Notice of the AGM and the standalone and consolidated audited financial statements for the financial year 2021-22, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, will be sent electronically to those Members of the Company, whose e-mail address is registered with the Company / KFinTech / Depository Participant(s) / Depositories. The Notice of AGM and the aforesaid documents will also be available on the Company's website at www.relianceretail.com and on the website of Company's Registrar and Transfer Agent, KFin Technologies Limited ("KFinTech") at

https://evoting.kfintech.com. Manner of registering / updating e-mail address:

- (a) Members holding shares in physical mode, who have not registered / updated their e-mail address with the Company, are requested to register / update the same by writing to the Company with details of folio number, e-mail address and attaching a self-attested copy of PAN card at retail.secretarial@ril.com or to KFinTech at rrlinvestor@kfintech.com.
- Members holding shares in dematerialised mode, who have not registered / updated their e-mail address with their Depository Participant(s), are requested to register / update the same with the Depository Participant(s) where they maintain their demat accounts.

Manner of casting vote(s) through e-voting:

Members can cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting"). The manner of voting, including voting remotely ("remote e-voting") by Members holding shares in dematerialised mode, physical mode and for Members who have not registered their e-mail address has been provided in the Notice of the AGM. Members attending the AGM who have not cast vote(s) by remote e-voting will be able to vote electronically ("Insta Poll") at the AGM.

Joining the AGM through VC/ OAVM:

Members will be able to attend the AGM through VC / OAVM, through JioMeet, at https://jiomeet.jio.com/rrlagm. The information about login credentials to be used and the steps to be followed for attending the AGM are explained in the Notice of AGM.

Members are requested to carefully read the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or voting at the AGM.

> By order of the Board of Directors K. Sridhar

> > Company Secretary

BENGALURU

financialexp.epa.in

Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF)

1) In case you hold shares in physical form: Duplicate share certificate(s) will

28366620. FOR GRP LIMITED

Place: Mumbai Date: 7th September, 2022

Notice is hereby given that the 21" Annual General Meeting (AGM) of the members of 'Insurance Brokers Association of India' ("the Company") will be held on Friday, 16" September, 2022 at 11:00 A.M., at Walchand Hirachand Hall, Forth Floor, Indian Chamber of Commerce & Industry (IMC), IMC Building, Churchgate, Mumbai

system of Central Depository Services (India) Limited. Kindly refer the Notice regarding the instructions on e-voting. The Notice will be also available on the

The facility for e-voting shall be made available at the AGM and the members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at the meeting. The members who have exercised their vote through remote e-voting may

The members whose names are recorded in the Register of Members, as on the

By Order of the Board

નિવેદનમાં જણાવ્યું હતું કે,

ફરજિયાત મોટર વ્હિકલ નિયમોમાં

પ્રવાસીઓની

અદ્યિકૃત અદ્યિકારી

સરકાર ૮ સીટના વાહનોમાં ૬ એર

બેગને ફરજિયાત કરે તેવી સંભાવના

સરકાર ઓક્ટોબરથી કાર લેટરલ ઈમ્પેક્ટ સામે મોટર

નવી દિલ્હી, તા.૭



Indian Bank

ઇન્ડિયન બેંક (જુની અલ્લાબાદ બેંક) : રાજકોટ ઝોનલ ઓફીસ / આદિપુર રોડ શાખા, ગાંધીનધામ સાંઇ કોમ્પલેસ, ૧૯૪, ડીબીઝેડ સાઉથ, શિવાજી પબ્લીક ગાર્ડન સામે, ગાંધીધામ (કર્જી), ગુજરાત,

આથી ઇન્ડિયન બેંક (જુની અલ્હાબાદ બેંક) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એંન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (બીજો) એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો,૨૦૨૨ ના (નિયમ ૩,૮,૯)સાંથે વંસાતી કલમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને તારીખ ૨૧.૦૪.૨૦૨૨ ના રોજ માંગણા નોટીસ જારી કરી **દેવાદાર શ્રી શકિલ ગફુર ધફાણી** (દેવાદાર/ગીરવેદાર), શ્રીમતી સનાનાઝ શકિલ ધફાણી (દેવાદાર) અને શ્રી શાંઝિદ ગફુર દ્યકાણી (જામીનદાર) ને નોટીસમાં જણાવેલ ૨કમ રૂા. ૨૪,૬૮,૨૦૦.૯૯/– (રૂપિયા ચોવીસ લાખ અંડરાઠ હજાર બસો અને નવ્વાણું પૈસા પુરા)વત્તા લાગુ ન કરેલ વ્યાજ અને ૨૨.૦૪.૨૦૨૨ થી **બાકી ખર્ચ** જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. દેવાદારો/ ગીરવેદાર/જામીનદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, દેવાદારો/ગીરવેદાર/જામીનદારો અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩,૮,૯ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમે (૪) હેઠળ તેમને પ્રાપ્ત રાત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતનો કબજો **દ સપ્ટેમ્બર. ૨૦૨૨** ના રોજ લઇ લીધો છે.

ખાસ કરીને દેવાદારો/ગીરવેદાર/જામીનદારો અને જાહેર જનતાને આથી મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો ઇન્ડિયન બેંક (જુની મલ્હાબાદ બેંક), આદિપુર રોડ બ્રાન્ચ, ગાંધીધામ ની રકમ ગ્ન. ૨૪,૬૮,૨૦૦.૯૯/– (રૂપિયા ચોર્વીસ લાખ અડસઠ હજાર બસો અને નવ્વાણું પૈસા પુરા) વત્તા લાગુ ન કરેલ વ્યાજઅને ૨૨.૦૪.૨૦૨૨

સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ

પ્લોટ નં. ૪૬, રેવન્યુ સર્વે નં. ૨૬૭/૧, ઇશ્વરકૃપા રેસીડેન્સી, સંદ્ર–મૌલેશ્વર મહાદેવ મંદિર પાસે,

મિલકતની ચતુઃસીમા:(વીએઓ બાઉન્ડ્રીસર્ટીફીકેટ મુજબ):–ઉત્તર:પ્લોટ ન ં ૪૭,દક્ષિણ: પ્લોટ

નં. ૪૫, ૫ર્વ: લેન પછી પ્લોટ નં. ૫૧, પશ્ચિમ: રોડ.

તારીખ: ૦૬.૦૯.૨૦૨૨ સ્થળ: ગાંદીદામ

જીઆરપી લીમીટેડ

CIN: L25191GJ1974PLC002555

રજીસ્ટર્ડ ઓફીસ : પ્લોટ નં. ૮, જીઆઇડીસી એસ્ટેટ, અંકલેગ્લર-૩૯૩ ૦૦૨, જિલો–ભરૂચ, ગુજરાત. ન : ૦૨૬૪૬ ૨૫૦૪૭૧, છમેઇલ : investor.relations@grpweb.com વેબસાઇટ : wv

શેરહોલ્ડરોને નોટીસ

ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ) માં કંપનીના ઇક્વિટી શેરહોલ્ડરોની કેરબદલી

ખાથી શેરહોલ્ડરોને જાણ કરવામાં આવે છે કે ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન કંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રીફંડ) નિયમો, ૨૦૧૬ (નિયમો), સુધારા મુજબના કંપની કાયદા ૨૦૧૩ની કલમ ૧૨૪ (૬) ની જોગવાઇઓ અન્વયે, નાણાંકિય વર્ષ, ૨૦૧૪-ુ ૧૫ માટે જારી કરાયેલ ડિવિડન્ડ ,જેસાત વર્ષના ગાળાથી દાવા રહીત છે, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજઆઇઇપીએ ફમાં જમા કરવામાં આવશે.સતત સાત વર્ષ થી દાવા રહીત અથવા બિન ચુકવાચેલ ડિવિડન્ડોને અનુરૂપ શેર્સ પણ નિયોમાં જ્ણાવેલ પ્રક્રિયા અનુસાર ફેરબદલ કરવામાં આવશે. નિયમોના અનુપાલન અંતર્ગત, ઉપ૨ જણાવેલ નિયમો મુજબ લાગતા વળગતા તમામ શે૨હોલ્ડરો જેમના શેર્સ આઇઇપીએફમાં ફેરબદલીને પાત્ર છે તેઓને વ્યક્તિગત નોટીસો મોકલવામાં આવી રહી છે, આવા શેરહોલ્ડરોની સંપુર્ણ વિગતો કંપનીની વેબસાઇટ nttps://www.grpweb.com/investors ઉપર પણ ઉપલબ્ધ છે.

ઝાના અનુસંધાનમાં, નોંધ લવી કે: **૧) તમારા ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગના કિસ્સામાં** : ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ (ટો) જારી કરવામાં આવશે અને આઇઇપીએ ફમાં ફેરબદલ કરવામાં આવશે. તમારા નામે રજીસ્ટર્ડ અને તમારી પાસે રહેલ ઓરીજનલ શેર સર્ટી ફીકેટ આપમેળે રદ થશે.

<mark>૨) તમારા <mark>ઇલેક્ટ્રોનિક સ્વરૂપે શેરહોલ્ડીંગના કિસ્સામાં</mark>: તમારા ડિમેટ એકાઉન્ટ</mark> આઇઇપીએ ફમાં ફેરબદલીને પાત્ર શેરો માટે ડેબીટ કરવામાં આવશે.

સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ અથવા એ પહેલા માન્ય દાવાઓ ન મળવાના કિસ્સામાં, કંપની કોઇપણ અન્ય નોટીસ વગર આઇઇપીએફ ઓથોરીટીની તરફેણમાં ફેરબદલીને પાત્ર ડિવિડન અને ઇક્વીટી શેરોની ફેરબદલી માટે કાર્ચવાહી કરશે. નોંધ લેવી કે જણાવેલ નિયમો અન્વયે ખાઇઇપીએફમાં તબદીલ કરાચેલ દાવા રહીત ડિવિડન્ડની રકમ અને શેર્સના સં બંધમાં કંપની સામે કોઇ દાવો માન્ય ગણાશે નહી. નોંધે લવી કે લાગતા વળગતા શેરહોલ્ડરો નિયત કરાયેલ ફોર્મ ખાઇ**ઇપીએએફ–૫ માં ઓનલાઇન અર**જી કરીને અને ફોર્મ આઇઇપીએફ–૫માં દર્શાવેલ આવશ્યક દસ્તાવ્જોની ફીઝીકલ નકલો મોકલીને કંપનીના નાયબ અધિકારીને આઇઇપીએફ ઓથોરીટીમાંથી શેર્સ અને ડિવિડન્ડ માટે દાવો કરી શકે છે

ઉપરોક્ત મામલાઓ પર કોઇપણ પુછપરછો માટે, શેરહોલ્ડરોને investor.relations@grpweb.con ઉપર કંપનીને અરજ઼ કરવા વિનંતી છે અથવા કંપનીના રજ઼સ્ટાર અને ટ્રાન્સકર એજન્ટનો યુનિવર્સલ કેપીટલ સિક્યોરીટીઝ લીમીટેડ, સી-૧૦૧, ૨૪૭ પાર્ક, એલબીએસ રોડ, વિખ્રોલી વેસ્ટ, મુંબઇ– ૪૦૦૦૮૩, ઇમેઇલ: info@unisec.in ટેલિ. નં. +૯૧–૨૨–૨૮૩૬૬૬૨૦ ઉપર સંપર્ક કરવ વિનંતી છે.

જાઆરપી લીમીટેડ વતી હર્ષ આર. ગાંધી તારીખ : ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટર



તેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ સાથે જાતદ્રાત જારુ જાણાવાજ આપ્રાલાગાધારા છે જ્લાર અંગર પાંચા જાયા લાગાધારા છે જ્લાર (જાણાવાજ) ફુલા, ૨૦૫૮ સાધા સંગાતી કક્ષમ ૧૩ કેઠળ મળેલી સામાત્રી એ ૭૦.૭૦% ૨૦૨ સા ગોજ મોણા નોટીસ જો છે. કરીને કે**દ્રાહાર/જાનેને લાગે તેને સ્વ** શ્રી બસિર ચેમ. સેખ, શ્રી સાઇલ બી. રોખને નોટીસમાં જણાવેલ ૨કમ ગ્રૂા. ૭,૬૨,૫૯૦.૭૫/− (રૂપિયા સાત લાખ બાંસઠ હજાર ર **પાંચસો નેતું અને પંચોનેર પૈસા પુચ) ૦૬.૦૪.૨૦૨**૨ મુજબ અને તેના પરનું ચક્ત વ્યાજ અને ખર્ચ આ નોટીસની તારીખ/ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યુ હતું. દેવાદાચો/જામીનદાર/મીરવેદાર રકમની પરન ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, દેવાદાચો/જામીનદાચો/મીરવેદારો અને જાહેર જનતાને

તાથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ નિયમોના નિયમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટની ક્લમ ૧૩ (૪) હેછા મને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતનો ક્રમજો **૦૬ સપ્ટેમ્બર, ૨૦**૨૨ ના રોજ લઇ લીધો છે. તાથી ખાસ કરીને દેવાદારો/જામીનદારો/ગીરવેદારો અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે સદરહં મિલકત સાથે કોઇ સોદો રવો નાહી અને આ મિલકત સાથે કરેલ ક્રોઇપણ સોદો બેંક ઓફ બરોહાની રક્ષ્ય જ્ઞા. **૭,૬૨,૫૯૦.૭૫/- ૦૬.૦૪.૨૦૨૨ મુજ**ળ રેપુરી ચુક્રવણી સુધી તેના પરના ચક્રત વ્યાજ અને ખર્ચની ચુક્રવણીના ચાર્જને આધિન રહેશે. સિક્યોર્ડ ચેસેટ છો પ્રવવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં એક્ટની કલમ ૧૭ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદાએનું

સ્થાવર મિલકતની વિગત

ફ્લેટ નં. ચે-૨૦૯ અને એ-૨૧૦, બીજો માળ, બિલ્ડીંગ નં. એ, ''નઝર રેસિડેન્સી'', ગામ-કારવડ, તાલુકો-વાપી, જિલ્લો-વલસા ।।तेनी भिद्ध स्तना तभाभ भाग थने दिन्ना

इंडियन बैंक Indian Bank

🛕 इलाहाबाद

થવઃ વાષી તારીખઃ ૦૬.૦૯.૨૦૨૨

ન્ડિયન બેંક (જુની અલ્હાબાદ બેંક) : રાજ્કોટ ઝોનલ ઓફીસ / આદિપુર રોડ શાખા, ગાંધીનધામ સાંઇ કોમ્પલેક્ષ, ૧૯૪, ડીબીઝેડ સાઉથ, શિવાજી ૫૦લીક ગાર્ડન સામે, ગાંધીધામ (ક્ચ્છ), ગુજરાત, ફોન/ફેક્સ : ૦૨૮૩૬૨૨૯૪૯૪, **ઇમેઇલ**: g519@indianbank.co.ir

(સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ-૮(૧) હેઠળ) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે) આથી ઇન્ડિયન બેંક (જુની અલ્હાબાદ બેંક) ના નીસે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (બીજો) એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ નિયમો,૨૦૨૨ ના (નિયમ ૩,૮,૯)સાથે વંજ્ઞાતી ક્લમ ૧૩(૧૨)હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરી

તારીખ રદ, ૦૫.૨૦૨૨ ના રોજ માંગણા નોટોસ જારી કરી દેવાદાર શ્રી અનંત ગોપાલ સ્ટાર (દેવાદાર/ગીરવેદાર) અને શ્રી રજત વિજય વાલિયા (જમીનદાર) ને નોટોસમાં જણાવેલ રકમ રૂ ૨૪,૭૯,૯૯૮.૭૮/– (રૂપિયા ચોલીસ લાખ ઓગણએંસી હજાર નવસો અક્રાણું અને ઇઠ્યોતેર પૈસ પુરા)વત્તા લાગુ ન કરેલ વ્યાજ અને ૨૭.૦૫.૨૦૨૨ થી બાકી ખર્ચ જણાવેલ નોટીસે મળ્યાન તારીંખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. તારાખથા ફુંઇ ાદવસના અદર યુક્યવા જણાવ્યું હતું. દેવાદારો/ગિરેવદાર/જમીગદારો સ્કમનીપરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી,દેવાદારો ગીરવેદાર/જમીનદારો અને જાહેર જ્નતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરના:

સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ર૦૦૨ ના નિયમ ૩,૮,૬ સાથે વંચાતી એક્ટર કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતન ક્બ**ો દ્ર સપ્ટેમ્બર, ૨૦૨૨** ના રોજ લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો/ ગીરવેદાર/જામીનદારો અને જાહેર જનતાને આથી મિલકત સાથે કોઇ સોદ

ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલક્ત સાથેનો કોઇપણ સોદો ઇન્ડિયન બેંક (જુની અલ્હાબાદ બેંક), આદિપુર રોડ બ્રાન્ચ , ગાંધીધામ ની રકમ ગ્ર. ૨૪ ,૭૯ ,૯૯૮ .૭૮/– (રૂપિયા ચોવીસ લાખ ઓગણએંટ્રી હજૂર નવસો અફાણું અને ઇઠ્યોતેર પૈસા પુરા)વત્તા લાગુ ન કરેલ વ્યાજ અને રહ.૦૫.૨૦૨૨ થી બાકી ખર્ચના ચાર્જને આદિન રહેશે. સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલ

(૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે. રથાવર મિલકતની વિગત:

રેસીડેન્સીયલ ફ્લેટ નં. એસ–૨, બીજો માળ, પ્લોટ નં. ૪૦૬, વોર્ડ નં. ૩/એ, આદિપુર, ક્ચ્છ ગુજરાત-૩૭૦૨૦૫ ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. સેલ ડીડ નં. ૩૪૦ ટાઇટલ ડીડ મુજળ), તારીખ ૦૩.૦૭.૨૦૧૮

મેલકતની ચતુઃસીમાઃ ઉત્તરઃ સીડીઓ અને ફ્લેટ નં. એસ–્૩, દક્ષિણઃ ખુલી જગ્યા, પુર્વઃ ખુલી જગયા. પશ્ચિમ: ક્લેટ નં. એસ-૧. એસએક. મિલકતના માલિક: શ્રી અનંત ગોપાલ રાય. બિ મપ એરિયા ૬૩.૮૨ ચો.મી.

અદિાકૃત અદિાકારી ઇન્ડિયન બેંક તારીખ: ૦૬.૦૯.૨૦૨૨

ઉત્પાદકો માટે આઠ સીટર વાહનના વાહનોમાં ઓછામાં ઓછી છ સલામતી વધારવા માટે સેન્ટલ એરબેગ્સને બનાવવાનો પ્રયાસ કરી રહી સુધારો કરીને સલામતીની ચધિકૃત અધિકારી (બેંક ચોફ બરોડા) છે, જેથી ઓક્ટોબરથી સુવિધાઓ વધારવાનો નિર્ણય પ્રવાસીઓની સુરક્ષામાં વધારો લેવામાં આવ્યો છે. ૧૪ કરી શકાય, તેમ માર્ગ પરિવહન જાન્યુઆરી, ૨૦૨૨એ ડ્રાફ્ટ પ્રધાન નીતિન ગડકરીએ નોટિફિકેશન બહાર પાડવામાં

ALLAHABAD

આતમાં માર્ગ પરિવહન અને આપવામાં આવ્યો છે. इंडियन बैंक

Indian Bank

જણાવ્યું છે. આ વર્ષની શરૂ આવ્યું છે જેમાં આદેશ

ALLAHABAD **ઇન્ડિયન બેંક (જુની અલ્લાબાદ બેંક**) : રાજકોટ ઝોનલ ઓફીસ / આદિપુર રોડ શાખા, ગાંધીનધામ સાંઇ કોમ્પલેસ, ૧૯૪, ડીબીઝેડ સાઉથ, શિવાજી પબ્લીક ગાર્ડન સામે, ગાંધીધામ (કર્સ્થ), ગુજરાત,

ફોન/ફેક્સ : ૦૨૮૩૬૨૨૯૪૯૪, છ્રમેઇલ: g519@indianbank.co.in (સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ–૮(૧) હેઠળ) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

ખાથી ઇન્ડિયન બેંક (જૂની અલ્હાબાદ બેંક) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સે ક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (બીજો) એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ નેયમો ,૨૦૨૨ ના (નિયમ ૩,૮,૯)સાથે વંસાતી કલમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરી તારીખ ૧૬.૦૬.૨૦૨૨ ના 'રોજ' માંગણા નોટીસ જારી કરી <mark>દેવાદાર કોમલ પ્રવીણ જેન</mark> (દેવાદાર/ગીરવેદાર), શ્રીપ્રવીણ જેઠમલ જેન (દેવાદાર/ગીરવેદાર) અને શ્રી અર્જુન રદ્યબિર ચંદ્ર **ાંસલ (જામીનદા૨)** ને નોટીસમાં જણાવેલ ૨કમ રૂ. ૨૮,૮૧,૫૮૬/– (રૂપિચા અઠ્યાવીસ લા એક્સાંસી હજાર પાંચરો છુચાંસી પુરા)વતા લાગુ ન કરેત સ્થારણ ન વહેરા છેલ્લાસા લાગે એક્સાંસી હજાર પાંચરો છુચાંસી પુરા)વતા લાગુ ન કરેત લ્લાજ અને ૧૭.૦૬,૨૦૨૨ થી બાકી ખર્ચ જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવણી જ્યાવ્યું હતું. દેવાદારો/ ગીરવેદાર/જામીનદારો અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે દેવાદારો/ ગીરવેદાર/જામીનદારો અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે

સેક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩,૮, ૯ સાથે વંચાતી એક્ટર્ન કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપચોગ કરીને નીચે જણાવેલ મિલકતને ક્બ**જો દ્ર સપ્ટેમ્બર, ૨૦૨૨** ના રોજ લઇ લીધો છે.

ખાસ કરીને દેવાદારો/ગીરવેદાર/જામીનદારો અને જાહેર જનતાને આથી મિલકત સાથે કોઇ સોદો બારા કરાંગા દ્વારાસ) ગારવંદાર/ગામાંબારા અખે વાહર ખેતાના બાવા તાનકરા તાલે કોઇ તા ન કરવા તાલંદા કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો ઇલ્ડિંચન બેંક (જુર્ન અલ્હાબાદ બેંક), આદિપુર રોડ બ્રાન્ચ, ગાંધીધામ ની રકમ ગ્રૂ. ૨૮ ,૮૧,૫૮૬/– (રૂપિયા અહ્યાવીર્ટ્ લાખ એક્ચાંસી હજાર પાંચસો છ્ચાંસી પુરા)વત્તા લાગુ ન કરેલ વ્યાજ અને ૧૭.૦૬.૨૦૨૨ થી બાકી

ાર્ચના ચાર્જને આદ્યિન રહેશે. સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

(૯) બા ગાંગવાઇએક પ્રત્ય દેવાદારાનું વ્યાગ તરાવાના આવે છે. **સ્થાવર મિલકતની વિગત:** પ્લોટ નં. ૩૧૩ અને ૩૧૪, રેવન્ચુ સર્વે નં. ૪૭૪, બાગેશ્રી ટાઉનશી૫–૦૫, મુકામ: વરસામેડી, તાલુકો અંજાર, જિલો ક્ચ્છ, ગુજરાત–૩૭૦૧૧૦, ક્રમ નં. સેલ ડીડ નં. ૧૭૭૭ (ટાઇટલ ડીડ મુજબ), તારીષ્ 9.0.૩.૨૦૧૫ ખાતેના સ્સીડેન્સીચલ હાઉસની સ્થાવર મિલક્તના તમામ ભાગ અને હિસ્સા મિલક્તની ચતુઃસીમાઃ (પ્લોટ નં. ૩૧૩ ની) ઃ ઉત્તરઃ પ્લોટ નં. ૩૧૪, દક્ષિણઃ પ્લોટનં. ૩૧૨, પૂર્વ ૧૨.૨૦ મીટર પહોળો રોડ, પશ્ચિમ: ૧.૫૨ મી. લેન ત્યારબાદ પાર્ક પ્લોટ નં. ૨૧૮ અને ૨૧૮ મિલકતની ચતુઃસીમાઃ (પ્લોટ નં. ૩૧૪ની) ઉત્તરઃ પ્લોટનં. ૧૨.૨૦ મીટર રોડ, દક્ષિણઃ પ્લોટ નં ૩૧૩, પૂર્વઃ ૧૨.૨૦ મી. રોડ, પશ્ચિમઃ ૧.૫૨ મી. લેન ત્યાર બાદ પાર્ક પ્લોટનાં. ૨૧૬, ૨૧૭ અને ૨૧૮

મિલકતના માલિક: શ્રી કોમલ પ્રવીણ જેન અને શ્રી પ્રવીણ જેઠમલ જેન જમીનનું ક્ષેત્રફળ ૨૧૦.૪૬ ચો.મી. અને તેના ૫૨ બંધાચેલ બિલ્ડીંગ તારીખ: ૦૬.૦૯.૨૦૨૨

NOTICE

The CANARA Workshops Limited

Registered office: V S Kudva Road, Maroli, Mangalore 575005 CIN:U51909KA1943PLC001075 Phone No: (0824)-2211649, 2213402 **NOTICE TO THE MEMBERS**

The 79th Annual general meeting of the shareholders of The Canara Workshops imited will be held on Wednesday 28th day of September 2022 at 10.00 A.M. at the registered office of the company situated at V. S. Kudva Road,Maroli, Mangalore 575005, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") to transact the business set out in the Notice callin

In compliance with the relevant circulars, the Notice of the AGM and the financial statements for the financial year 2021-22, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, have been sent on 7th September, 2022 to the Members of the Company whose email addresses are registered with the Company / Depository Participant(s). The aforesaid documents are also available on the Company's website at www.canarasprings.in, and also on the website of the CDSL at

The documents referred to in the Notice of the AGM are available electronically for inspection without any fee by the members from the date of circulation of this Notice up to the date of AGM. Members seeking to inspect such documents can send an email to canarasprings@gmail.com investor@canarasprings.com

Instruction for remote e-voting and e-voting during AGM:

અધિકૃત અધિકારી

The Company is providing to its members facility to exercise their right to vote on resolutions proposed to be passed at AGM by electronic means ("evoting"). Members may cast their votes remotely, using the electronic voting system ofCentral Depository Services (India) Limited (CDSL) on the dates mentioned here below ("remote e-voting").

Further, the facility for voting through electronic voting system will also be made available at the AGM by Central Depository Services (India) Limited (CDSL) and members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM through the "Easi/Easiest" facility mad available by Central Depository Services (India) Limited (CDSL)

The Company has engaged the services of Central Depository Services (India) Limited (CDSL) as the agency to provide e-voting facility. Information and instructions including details of user id and password relating to e-voting have been sent to the members through e-mail. The manner of remote e-voting and voting by members in the AGM holding shares in dematerialized mode, physical mode and for nembers who have not registered their email addresses is provided in the Notice of the AGM and is also available on the website of the Company: www.canarasprings.in and also on the website of the CDSL at

The remote e-voting facility will be available during the following voting period: Commencement of remote e-voting: 9:00 a.m. on Saturday, 24th September, 2022 End of remote e-voting: 5:00 p.m. on .Tuesday, 27th September, 2022

The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by CDSL upon expiry of the aforesaid period. A person, whose name is recorded in the register of members or in the

register of beneficial owners maintained by the depositories as on the cut-off date, i.e. Tuesday, 20th September, 2022 only shall be entitled to avail the facility of remote e-voting or for participation at the AGM and voting through Easi/ Easiest. Manner of registering / updating email addresses is as below:

The shareholders who have not registered their email address and in ce the AGM notice could not be serviced may get their email address registered with the Company by sending an email to the company at <u>canarasprings@gmail.com./investor@canarasprings.com.</u> In case of any queries, hareholder may write to — BoSE Financials Limited. Stock Exchange Towers. No.51, 1st Cross, J.C.Road, Bangalore- 560027. Ph. No. 080 41329661, E-mail: cs rta@bfsl.co.in or avp rta@bfsl.co.in

Members holding shares in dematerialised mode, who have not registered /updated their email addresses with their Depository Participants, are requested to register / update their email addresses with the Depository Participants vith whom they maintain their demat accounts.

Any person who becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date may obtain the User ID and password in the manner as provided in the Notice of the AGM, which i available on Company's website and CDSL's website.

Such members may cast their votes using the e-voting instructions, in the manner specified by the Company in the Notice of AGM. The members who have cast their vote(s) by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote(s) again at the AGM.

In case of any query pertaining to e-voting, members may go through the instructions given in the notice and in case of any queries connected with e voting, the user manual is available at download section of www.evotingindia.com help section or write an email to helpdesk.evoting@cdslindia.com.ln case of any grievances with respect to e-voting, you may contact CDSL by e-mail at evoting@cdsl.co.in or write to the Company at canarasprings@gmail.com investor@canarasprings.comor to RTA at following address:

BoSE Financials Limited. Stock Exchange Towers. No.51, 1st Cross, J.C.Road Bangalore-560027. Ph. No. 080 41329661 E-mail:cs_rta@bfsl.co.in or avp_rta@bfsl.co.in

Place: Mangalore

For THE CANARA WORKSHOPS LIMITED

Chairman & Managing Director PREMNATH SRINIVAS KUDVA DIN: 00126024

BY ORDER OF THE BOARD

સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ–હરાજીની જાહેર નોટીસ સેક્ચોરીટાઇપ્રેશન અને રીકન્સ્ટ્ક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (અહીં પછી એક્ટ તરીકે દર્શાવેલ છે) હેઠળ બાઇઆઇએફએલ હોમ ફાયનાન્સ લીમીટેડ (અગાઉઇન્ડિયા ઇન્ફોલિન હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ તરીકે જાણીતી) કોર્પોરેટ ઓફીસ: પ્લોટ નં. ૯૮,ઉઘોગ વિહાર ,ફેઝ-૪,ગુરગૉવ, ૧૨૦૦૧૫ (હરિયાણા) અને શાખા ઓફીસ: **ઓફીસ નં. ૭૦૧, સાતમો માળ, ૨૧ સેન્ચુરી બિઇનેસ સેન્ટર, ઉદ્યના દરવાજા પાસે, ઉંગ રોક, સુરત-૩૯૫૦૦૨ ને ગીરો કરાવેલ તેંચાવર મિલડતોનું વેચાણ, જણાવાનું કેઝાઇઆઇએફએલ—એચએફએલના અધિકૃત અધિકાર્દી (એઓ) એ નીચેના એલાઉન્ટી/પ્રોસ્પેક્ટન, માંએક્ટની કલમ૧૩(૨) ઢંઠળ જારી કરાવેલ નોટીસ અન્વયે નીચેની મિલડત/તોનો કરાવેજો આઇઆઇએફએલ—એચએફએલની બારીક્ટનની વસુલાત માટે "જ્યાં છે", "જેછે"ના ધોરણે લઇ લીધો છે. વેચાણ નીચે સઢી કરનાર દ્વારા વેબસાઇટ www.bankeauctions.com પર પુરા પડાયેલ ઈ–હરાજી પ્લેટફોર્મ મારફત વેચવામાં આવશે.**

(રા) / જામીનદાર(રો) / જામીનદાર(રો)	માંગણા નોટીસન તારીખ અને રક		સ્થાવર મિલકત / મિલકતોની વિગત/ સિક્યોર્ડ એસેટ	ભાત્તિક કબજાની તારીખ	રિઝર્વ રકમ
૧. શ્રી સોનલાપલસિંઘ ૨. શ્રીમતી માચાદેવી (પ્રોસ્પેક્ટ નં. ૮૨૩૦૭૧)	the contraction of the first black of the contraction of		પ્લોટ નં. ૭૧, એરિયા ક્ષેત્રફળ ૪૦.૧૯ ચો.મી., જોલ્વા રેસિડેન્સી, તાલુકો–પલસાણા, જોલ્વા, સુરત– ૩૯૪૩૦૫, ગુજરાત, ભારત ખાતેની	૧૫–જુલાઈ–૨૦૨૨ ૨૯–ઓગષ્ટ–૨૦૨૨ ના રોજ બાકી રકમ	રૂા. ૧૩,૨૫,૦૦૦/– (રૂપિચા તેર લાખ પચ્ચીસ હજાર પુરા)
(રૂા. ૧૫,૫૫,૨૨૪/–	અનેંસ્ટ મની કિપોઝીટ (ઇએમડી)
	રૂા. ૨૫,૦૦૦ <i> </i> (રૂપિયા પરચીસ હજા	-	મિલકતના તમામ ભાગ અને હિસ્સા.	(રૂપિયા પંદર લાખ પંચાવન હજાર બસ્સો ચોવીસ પુરા)	રૂા. ૧,૩૨,૫૦૦/– (રૂપિયા એક લાખ બત્રીસ હજાર પાંચસો પુરા)
૧. શ્રી કિશનશંદ સિંઘ	કર્ય-હૈવ-ક૦ક	۹	પ્લોટ નં. ૧૩૧, ક્ષેત્રફળ ૪૮ ચો. ચાર્ડ, સ્વર્ગ વિલા, કારેલી પલસાણા,	ભૌત્તિક કળજો	३१. १३,०३,६००/-
ર. શ્રીમતી રિતુ સિંઘ	રૂા. ૧૨,૯૦,૬૨૩	•		૨૭-ઓગષ્ટ-૨૦૨૨	(રૂપિયા તેર લાખ ત્રણ હજાર છસ્સો પુરા)
(પ્રોસ્પેક્ટ નં. ૮૫૮૨૪ <i>૭</i> , ૯૪૩૨૫૩)	(રૂપિયા બાર લાખ નેવું હ ત્રેવીસ પુરા)	જાર છસ્સો	પલસાણા,સુરત–૩૯૪૩૦૫,ગુજરાત, ભારત ખાતેની મિલકતના તમામ	30–ઓગષ્ટ–૨૦૨૨ ના રોજ બાકી રકમ	અનેંસ્ટ મની કિપોઝીટ (ઇએમડી)
	બિક વૃદ્ધિની રકમ		ભાગ અને હિસ્સા.	ફા. ૧૪,૭૨,૦૨૨/–	રૂા. ૧,૩૦,૩૬૦/– (રૂપિચા એક લાખ ત્રીસ હજાર
	રૂા. ૨૫,૦૦૦/ (રૂપિયા પચ્ચીસ હજા			(રૂપિયા ચૌદ લાખ બોત્તેર હજાર બાવીસ પુરા)	ત્રણસો સાહીઠ પુરા)
૧. શ્રી સંદિપભાઇ રાજાભાઇ	0 01		પ્લોટ નં. ૨૮, ક્ષેત્રફળ ૮૧૦ ચો. ફુટ, રાજ મંદિર રેસિડેન્સી, સર્વે નં. ૩૦૧,	ભૌત્તિક કબજો	રૂા. ૧૧,૧૮,૧૦૦ /– (રૂપિચા અગિચાર લાખ અઢાર
ગેવરિયા ૨. શ્રીમતી જિનલ				ર૧-ઓગષ્ટ-૨૦૨૨	હજાર સો પુરા)
સંદિપભાઇ ગેવરિયા	અઢાર પુરા) આગવાર લાખ સાત્તર હ	જાર બસ્સા	બ્લોક નં. ૨૮૮/૮, શેખપુર, કામરેજ,	ર3-ઓગષ્ટ-૨૦૨૨ ના રોજ બાકી રકમ	અનેંસ્ટ મની કિયોઝીટ (ઇએમડી)
3. મોક ટેલ સોડા એન્ડ આઇસ્ક્રીમ ૪. શ્રી તુષાર વિનુભાઇ સિંગાળા (પ્રોસ્પેક્ટ નં. ૮૮૫૯૫૩૭)	બિક વૃદ્ધિની રક ફ્રા. ૨૫,૦૦૦/ (રૂપિયા પરચીસ હજા	-	સુરત-૩૯૪૧૮૦, ગુજરાત, ભારત ખાતેનીમિલકતના તમામ ભાગ અને હિસ્સા.	રા. ૧૩,૨૨,૨૨૫/- (રૂપિયા તેર લાખ બાવીસ હજાર બસ્સો પચ્ચીસ પુરા)	રૂા. ૧,૧૧,૮૧૦/– (રૂપિયા એક લાખ અગિચાર હજાર આઠસો દસ પુરા)
મિલકતના નિરિક્ષણની તારીખ		ઇએમડીની છેલી તારીખ	ઇ–હરાજીની તારીખ / સમય		
૦૪–સપ્ટેમ્બર–૨૦૨૨ સવારે ૧	૦૪-સપ્ટેમ્બર-૨૦૨૨ સવારે ૧૧ થી બપોરના ૨ કલાક ૦૪-		-ઓક્ટોબર-૨૦૨૨ સાંજેપ કલાક સુધી	૧૦–ઓક્ટોબર–૨૦૨૨ સવારે ૧૧ થી બપોરના ૧ કલાક	
000					0.01 0 1

યુકવાશીની પદ્ધતિ :- તમામ ચુકવાશીઓ આરટીજીએસ/એનાઇએ ફરી ફ્રારા અથવા ગુરુગ્રામ ખાતે ચુકવવા પાત્ર "આઇઆઇએફએલ લોમ ફારાનાન્ય લીમીટેડ" ની તરફેરામાં ડીમાન્ટ સુરુ દ્વારા કરવાની રહેશે. એકાઉન્ટની વિગતો નીચે મુજવ છે. : (એ) એકાઉન્ટનું નામ: આઇઆઇએફએલ લોમ ફાયનાન્ય લીમીટેડ (બી) બેંકનું નામ: સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક લીમીટેડ, સી)એકાઉન્ટ નં. પત્ર૧૦૫૦૬૬૨૯૪,(ડી) આઇએફએસસી કોડ:– SCBL0036025 અથવા પેમેન્ટ લીંક https://quickpay.iiflinance.com,

નાં ભાગ લેવા માટે, રસ ધરાવતા બીડરોએ અગાઉથી સર્વિસ પ્રદાતા https://www.bankeauctions.com માં તેમની વિગતો રજુસ્ટર કરવી ૧૪૨૧ છે અને લોગીન એકાઉન્ટ ડી અને પાસવર્ડ બનાવવા ૧૪૨૧ છે. રસ ધરાવતા બીડરોએ ટેન્ડર ફોર્મ તેમજ છએમડીની ચુડવણીની વિગતો, ડેવાથસી અને પાન લાડની નહલ ઉપર ૧૪૫ાવેલ શાખા ઓ ફીસે ૧૦મ

ારાતા છાડા છાત્રાના અનાવા ત્રણ છે. દારાવામાં આદાઇ ઇન્ડર ફાર્ય પાતાના યુક્યલાના લગાત, કાવલાઇન માંગકા પાતાના આફાર કરાવા/મહિલાવા જરી છે. ૧. બીક્ટો બીડ વૃદ્ધિની રકમની દોલમ હેઠળ જ્યાવેલ રકમના ગુણકમાં તેમની ઓફ્ર્સમાં ચુંધારો કરી શકે છે. હરાજી બંધ થવાની છેશી પ મીનટમાં બીડ થવાના કિસ્સામાં, બંધ થવાની સમ

s. સફળ બીડ્ટે બીડની રઝના રપ ટડા (ઇએમડીની રડમ બાદ વ્ટીને) એઓ ફ્રારા બીડની ઉંમત મંજુર થયાના રજ ડલાડની અંદર જમા કરવાના રહેશે અને બીડની રકમના બાડીના ૭૫ ટડા

કે તકારી લોકા કુદ મના પહેલા (અમનકાન દુધના છે. કરાવ) અના ફુદા બાકમાં છતત મુશ્ક લાવાન અદ જમાં કરવાના રહ્યા બના અન કારકોર્ડ લોકા દુધા વેલાણની મુશ્કેની તારીષાથી પરિવાસની અંદર ભગ હવાના રહેલે. તમા જમાં અને વુડાણીઓ વુડાણીની રોતમાં જણાવ્યા મુજબ કરવાની રહેલે. અને પિલડતને સંબંધિત અન્ય બાહ્ય દરો ભોગવાના રહેલે. ય. બીકરોને ઇન્ટરાજુમાં ભાગ લેવા માટે તેમની બીડ જમાં કરતા પહેલા હરાજુ વેચાણ અરું હક્ષે કૃષ્મિની વિગતવાર શરતો અને બિચામે માટે વેબસાઇટન https://bankeauctions.com અને https://www.iifl.com/home-loans/properties-for-auction જોવા સલાહ છે. દુ. વિગતો, મદદ, પ્રક્રિયા અને ઇન્ટરાજુ અંગે ઓનલાઇન તાલીમ માટે ભાવી બીડરો સર્વિય પ્રદાનો ઇમેઇલ આઇડ support@bankeauctions.com સપોર્ટ હેલ્પાઇઇન ને ક્રિયા પ્રદાનો ઇમેઇલ આઇડ support@bankeauctions.com સપોર્ટ હેલ્પાઇઇન મારે ક્રિયા પ્રદાનો ઇમેઇલ આઇડ support@bankeauctions.com સપોર્ટ હેલ્પાઇઇન માટે ક્રિયાઇન કર્યા ક્રિયા પ્રદાનો ઇમેઇલ આઇડ support@bankeauctions.com સપોર્ટ હેલ્પાઇઇન માટે ક્રિયાઇન કર્યા ક્રિયા પ્રદાનો ઇમેઇલ આઇડ support@bankeauctions.com સપોર્ટ હેલ્પાઇલન કર્યા ક્રિયાઇન ક્રિયાઇન ક્રિયાઇન ક્રિયાઇન ક્રિયાઇન ક્રિયાઇન કરવા ક્રિયાઇન કરવા ક્રિયાઇન ક્રયાઇન ક્રિયાઇન ક

②૦૨૯૧૯૮૧૧૨૪/૨૫/૨૬ નો અને કોઇપણ મિલકત સંબંધિત પૂછપરછ માટે શ્રી જિતેન્દ્ર ગુપા +૯૧–૯૩૭૨૨૫૮૦૦૩ ઇમેઇલ આઇકી: jitendra.gupta1@iifl.com નો સંપર્ક કરી શકે છે. . આથી ઉપર બશાવેલ દેવાદારોને ઘરેવું સામાન જે ભૌતિક કબજો લેવા સમયે સિક્ચોર્ડ એસટેમાં હતો તે સાત દિવસની અંદર લઇ જવા જાણ કરવામાં આવે છે.

ર. દેવાદારોને વધુમાં નોટીસ આવામાં આવે છે કે, ઉપલ જ્યાવેલ વસ્તુઓ લેલામાં તેઓ નિષ્ફળ જો તો, કાવાદ અનુસાર દેવાયા કરવામાં આવછે. દ. દેવાદારોને વધુમાં નોટીસ આવામાં આવે છે કે, ઉપલ જ્યાવેલ વસ્તુઓ લેલામાં તેઓ નિષ્ફળ જો તો, કાવાદ અનુસાર વેચાણ કરવામાં આવશે. દ. ઉપર ન્યાવેલ સમયગાળામાં સફળ બીડર/હરાજી ખરીદદાર દ્વારા કોઇપણ સ્તરે ક્સુરના કિસ્સામાં, વેચાણ રદ કરવામાં આવશે અને પહેલેથી યુક્લેલ રકમ (છએમડી સહીત) જા કરવા અને મિલક્તનનું ફરી વેચાણ કરવામાં આવશે.

io. આદિકત અદિકારી કોદપણ કારણ જણાવ્યા વગર ટેન્ડર (હરાજાની શરતો અને નિયમોમાં ફેરફાર કરવાનો અથવા મૌવુફ/રદ કરવાનો હક અનામત રાખે છે. ટેન્ડર (હરાજીમાં કોદપણ વિવાદ

ક્સ્સામાં, આઇઆઇએફએલ-એવએફએલના અધિદૃત અધિદાર નો નિર્ણય અંતિમ ગણાશે. સરફેસી એક્ટર, ૨૦૦૨ ના નિયમ ૮ (૬) હેઠળ ૩૦ દિવસીય કાનુની વેચાણ નોટીસ પ્રાથી દેવાદારોને કેન્ડરની તાર્કીખતરણ પહેલા ઉપર જણાવેલ દગ મેતજ અંતિ પ્રદૃતિ પૂર્વી વ્યાપ્ય અને આક્સીઇ ખર્ચ ચુકવાવા પ્રધાવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં હરાજી અને વેચાઇ કરવામાં આવશે અને બાકી ૨૦મ જો કોઇ હોય તો વ્યાપ્ય અને ખર્ચ સહીત વસુલવામાં આવશે.

સહી/– અધિકૃત અધિકારી, આઇઆઇએફ્એલ હોમ ફાચનાન્સ લીમીટેડ તારીખ : ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૨, સ્થળ : સુરત

ZENLABS ETHICA LIMITED

Regd. Office: Plot No. 194-195, 3rd floor, Industrial area, Phase II, Ram Darbar, Chandigarh - 160002. Tel: 0172-4651105, Email: queries@zenlabsethica.com

CIN: L74900CH1993PLC033112 | Website: www.zenlabsethica.com

NOTICE OF 29™ ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE.

29th Annual General Meeting of Zenlabs Ethica Ltd will be held on Friday, the 30th day of September, 2022 at 11:30 a.m. at the registered office of the Company situated at Plot No. 194 - 195, 3rd Floor, Industrial Area, Phase II, Ram Darbar, Chandigarh - 160002 in compliance with applicable circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India to transact the business as set out in the notice dated 07.09.2022.

The Company has already dispatched the Annual Report for the Financial Year 2021-2022 along with the Notice convening AGM through electronic mode to the shareholders whose email addresses are registered with the Company and/or depositories in accordance with the circulars issued by Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with Notice of the AGM is also available on the website of the Company at www.Zenlabsethica.com, on the website of Central

Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com and on the website of BSE. Remote e-voting and e-voting during AGM

Pursuant to the provisions of section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the shareholders are provided with the facility to cast their votes on all the resolution as set forth in the Notice convening AGM using electronic voting system (Remote E-voting) provided by CDSL. The voting rights of shareholders shall be in proportion to their shares of the paid-up equity share capital of the company as on the cut-off date (record date) of Friday the 23rd

The shareholders are informed that the remote e-voting shall commence on September 27, 2022 at 9:00 a.m. and end on Septembe 29, 2022 at 5:00 p.m. IST. During this period, the shareholders may cast their vote electronically. The remote e-voting module will be disabled by the CDSL thereafter. Members holding shares either in physical form or in dematerialized form, as on cutoff date of September 23,2022, may cast their vote electronically on Ordinary and Special Business (es) as set out in Notice through electronic voting system of Central Depository Services (India) Limited (CDSL).

A shareholder may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again at AGM. In case of voting by both the modes, vote casted through remote e-voting will be considered final.

Any person who becomes shareholder of the Company after dispatch of Notice of the meeting and holding shares as on the cut-of date i.e. September 23, 2022 may obtain the login id and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. If the member is already registered with CDSL for remote e-voting, he can use his existing User lid and password for casting vote through

In case of any queries relating to voting by electronic means, shareholders may refer the Frequently Asked Questions ("FAQ") and e voting manual available at download section of www.evotingindia.com. Any queries/grievance relating to remote e-voting, shall be addressed to the Company's Registrar and Share Transfer Agent, Bigshare Services Pvt. Ltd, Office No S6-2, 6th Floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East) Mumbai – 400093. Tel No. 022-62638200 Extn.–206, Fax 022-62638299, M: 7045454392, E-mail: investor@bigshareonline.com or rajeshm@bigshareonline.com

Saniay Dhir Whole Time Director (DIN-02452461)

Place: Gurugram Dated: September 07, 2022

ફોન/ફેક્સ : ૦૨૮૩૬૨૨૯૪૯૪, ઇમેઇલ: g519@indianbank.co.in

ALLAHABAD

(સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨ના નિચમ-૮(૧) હેઠળ) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

થી બાકી ખર્ચના ચાર્જને આદિાન રહેશે.

(૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતની વિગત:

મેદાપર બોરીસી, તાલુકો– અંજાર, જિલો– કચ્છ–૩૭૦૧૧૦, ઓરીજનલ ત્રીપરટાઇટ એગ્રેમન્ટ નં ૪૮૩૨, શ્રી શકિલ ગંકુર ધકાણી/શ્રીમતી સનાનાઝ શકિલ ધફાણી અને મેસર્સ લછવાણી ઇન્ફા અને અલ્હાબાદ બેંક વસ્ત્રે તારીખ ૨૭.૦૬.૨૦૧૭ અને ત્રીપરટાઇટ એગ્રીમેન્ટના ઓરીજનલ કરેક્શન ડીડ નં. ૬૦૦૮ શ્રી શકિલ ગફ્સર ધંફાણી/શ્રીમતી સનાનાઝ શકિલ ધફાણી અને મેસર્સ લછવાણી ઇન્ફા ને અલ્હાબાંદ બેંક વસ્ત્રે તારીખ ૨૯.૦૦૭.૨૦૧૭ ખાતેના રેસીડેન્સીયલ ઘરની રથાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા.

મિલકતના માલિક: શ્રી શકિલ ગક્સર ધફાણી, સાઇટ એરિયા ૧૨૪.૯૩ ત્રો.મી. અને બિલ્ટ અપ

અદ્યિકૃત અદ્યિકારી

IndusInd Bank 🕝 પહેલો માળ, સંગમ ટાવર ચર્ચ રોડ , જ્યપુર–૩૦૨૦૦૧ 🥃 જોહેર

સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩(૧) હેઠળ) સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ

૧૩ (૨) હેઠળ નોટીસની વૈકલ્પીક બજવણી આથી નીચે જણાવેલ દેવાદારોને નોટીસ આપવામાં આવે છે કે તેઓએ ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડ (આઇબીએલ) પાસેથી તેમને મળેલ કેડીટ સવલતોની પરત ચુક્વણીમ ક્સુર કર્યો હોવાથી, તેમની લોન કેડીટ સવલતો આરબીઆઇ માર્ગદર્શીકામાં જણાવ્યા મુજબ બેંકની બુકમાં નોન પરફોમિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરાઇ છે. ત્યાર બાદ બેંકે સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટુક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફ્રૈસી એક્ટ) ની ક્લા ાંગણા નોટીસ/સોમાં જણાવેલ રકમો તેમજ નીચે જણાવેલ રકમ પર કરારના દરે ચડત વ્યાજ અને જણાવેલ માંગણા નોટીસમાં જણાવ્યા મુજબ આકરિમક ખર્ચ, કોસ્ટ ર્ધવગેરે ચકવવા જણાવ્યું હતું. આમ છતાં. સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો. ૨૦૦૨ (સરક્રૈસી નિયમો) ના નિયમ 3 મજબ આ પ્રકાશનના માર્ગે પણ અમે

દેવાદાર અને સહ-દેવાદારનું નામ અને સરનામું	લોન એકાઉન્ટ નંબર	એનપીએ ની તારીખ	માંગણ નોટીસની તારીખ	કુલ બાકી સ્ક્રમ (રૂા.) નીચેની તારીખ મુજબ	સિક્યોર્ડ એસેટ્સ / ગીરો મિલકતોની વિગત
૧. શ્રી શર્મિલા જવેશ ચાવડા જે રવ. શ્રી જવેશ અમૃતલાલ ચાવડાના પત્ની (સહ–દેવાદાર) (કાનુની વારસદાર સ્વ. શ્રી જવેશ અમૃતલાલ ચાવડા) ૨. શ્રી રોમિત જવેશ ચાવડા જે સ્વ. શ્રી જવેશ અમૃતલાલ ચાવડાના પુત્ર (સહ–દેવાદાર) (કાનુની વારસદાર સ્વ. શ્રી જવેશ અમૃતલાલ ચાવડા)	GRR00 568N	8-April -2022	20-August -2022	રૂ. 3,૪૧૦,૮૭૯.૯૦/– (રૂપિયા યોત્રીસ લાખ દસ હજાર આઠસો ઓગણૐશી પુરા) ૨૨–જુલાઇ–૨૦૨૨ મુજબ	જમીનનું ક્ષેત્રફળ ૧૮૧.૧૬ ચો.મી. આઘટ લાખ નં ૧૨/૧૯૦૮ પૈકી સિટી લોર્ડ સર્વે નં. ૫૨૪, ૫૨૫, ૫૨૬ "મીલપરા મેઇન રોડ" વિમલા મીલપરા એસટી નં. હ એ)ર૧, રાજકોટ સિટી, રાજથ–ગુજરાત, જે શ્રીમર્ત શર્મિલા જ્યેશ ચાવડા જે શ્રી જયેશ અને શ્રી રોમિત જ્યેશ ચાવડા જે શ્રી જ્યેશ અમૃતલાલ ચાવડાની માલિકીની સ્થાવર મિલક્તન ક્રોમ્પ્રોઝિંગ રેસિડેન્સીયલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પૂર્વ: મીલપરા મેઇન રોડ પશ્ચિમ: મીલપરા રોડ નં. ૨૧, ઉત્તર: મીલપરા રોડ નં. ૭–એ, જાહેર રોડ, દક્ષિણ : અન્ય હાઉસ્
૧. શ્રી અમિતકુમાર એન . કાપકિયા જે સ્વ. શ્રી નરેન્દ્રકુમાર પરમારના પુત્ર (દેવાદાર) (કાનુની વારસદાર સ્વ. શ્રી નરેન્દ્રકુમાર પરમાનંદ સ્વ. શ્રીમતી રતનાબેન પરમાર) અમો આથી દેવાદારોને આ નોટીસર્થ	GBC00 571N	22- January -2022	20-August -2022	રૂ. ૮૯૨,૬૭૭.૬૧/– (રૂપિયા આઠ લાખ બાણું હજાર છસ્સો સીત્યોતેર અને એક્સઠ પૈસા પુરા) ૨૨–જુલાઇ–૨૦૨૨ મુજબ	જ્મીનનો સી-૭, ગાથત્રીકુંજ સોસાયટી, સર્વે નં ૩૬૫,રાધાસ્વામીરોડ,રાણીપતાલુકા –સાબરમતી અમદાવાદ–૩૮૪૪૮૦ ગુજરાત ક્ષેત્ર ફળ બિલ્ટ અપ એરિચા ૧૨૭૧ સો. ફુટના તમામ ભાગ અને હિસ્સા સ્વ;સીમા : પુર્વ : ટેનામેન્ટ નં. સી–૬, પશ્ચિમ ટેનામેન્ટ નં. સી–૬, ઉત્તર : પ્લોટ નં. કોમન્ પાર્કિંગની જગ્યા, દક્ષિણ : અન્ય ટેનામેન્ટ

ચાર્જ, ખર્ચ વગેરેની ની વધુ વિગતો જારી કરાચેલ સંબંધિત માંગણા નોટીસમાં જણાવેલ છે, જેમાં નિષ્ફળ જતાં. અમે જણાવેલ એક્ટની કલમ ૧૩ (૪) અને લાગુ નિચમો મુજબ હેંઠળ સદરહું સિક્ચોર્ડ એસેટ(ટો)/સ્થાવર મિલકત (તો) સામે કાર્યવાહી કરવા સ્વતંત્ર છીએ જે કબજો લેવા અને સિક્ચોર્ડ એસેટનું વૈચાણ કરવા પુરતી મર્યાદિત નથી અને તે જણાવેલ દેવાદાર(રો)/સહ- દેવાદાર(રો)/કાનુની વારસદાર(રો)/કાનુની પ્રતિનિધિ(ઓ)ના ખરે

નોંધ લેવી કે સરફૈસી એક્ટની કલમ ૧૩(૧૩) હેઠળ તમો તમામને બેંકની આગોતરી મંજુરી વગર સદરહું સિક્ચોર્ડ એસેટનું વેચાણ, લીઝ અથવા અન્થ રીતે ટુાન્સફર કરવા મનાઇ ફરમાવામાં આવે છે. જણાવેલ કલમનો તમાર દ્વારા કોઇપણ પ્રકારે ભંગ સરફ્રેસી એક્ટ નો કલમ ર૯ અને/અથવા અ સંબંધમાં કોઇ અન્ય જોગવાઇઓમાં જણાવેલ પેનલ જોગવાઇઓને પાત્ર બનશે. નોંધ લેવી કે એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) મુજબ ,જો વેચાણ અથવા ટ્રાન્સ ફરની તારીખ પહેલા કોઇપણ સમયે આઇબીએલની બાકી રકમ તેમળ

આઇબી એલ દ્વારા લદાચેલ તમામ કોસ્ટ, ચાર્જ અને ખર્ચ આઇબીએલને ચુક્વવામાં આવશે, તો આઇબીએલ દ્વારા સિક્ચોર્ડ એસેટનું વેચાણ અથવા ટ્રાન્સફર કરવામાં આવશે નહી, અને સિક્ચોર્ડ એસેટના ટ્રાન્સફર અથવા વેસાણ માટે આઇબીએલ દ્વારા કોઇ અન્ય પગલાં લેવામાં આવશે નહી. તારીખ : ૦૮.૦૯.૨૦૨૨ ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડ વર્તી



SHALIMAR PAINTS LIMITED

(CIN: L24222HR1902PLC065611)

Regd. Office: Stainless Centre, 4th Floor, Plot No. 50, Sector-32, Gurugram, Haryana-122001 Corporate Office: 1st Floor, Plot No. 28, Sector - 32, Gurugram, Haryana - 122001 Website: www.shalimarpaints.com E-mail: askus@shalimarpaints.com Phone No.: +91 124 461 6600 Fax No. +91 124 461 6659

NOTICE OF THE 120[™] ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

SHALIMAR

- Notice is hereby given that: the 120th Annual General Meeting ("AGM") for the Financial Year 2021-22 of the members of Shalimar Paints Limited ("the Company") will be held on Thursday, September 29, 2022 at 12:30 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), to transact the businesses, as set out in the Notice of the AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") vide Nos. 14/2020, 17/2020, 22/2020, 33/2020, 39/2020, 10/2021, 19/2021 and 2/2022 dated April 08, 2020, April 13, 2020, June 15, 2020, September 28, 2020, December 31, 2020, June 23, 2021, December 08, 2021 and May 05, 2022, respectively (hereinafter collectively referred to as
- "MCA Circulars"), and Circulars issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars"), without the physical presence of the Members at a common venue. In terms of the MCA Circulars and SEBI Circulars, the Notice of the AGM and the Annual Report including the Audited Financial Statements for the financial year ended March 31, 2022 ("Annual Report") has been sent on September 07, 2022 only by email to the Members whose email addresses are registered with the Company/ Depository participants on September 02, 2022. The requirement of sending the physical copy of the Notice of the AGM to the members has been dispensed with vide MCA circulars and
- The members holding equity shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. September 22, 2022, may cast their vote electronically on the businesses as set out in the Notice of AGM through electronic voting systems of CDSL. All
- the members are informed that: 1. The Ordinary and the Special Businesses as set out in the Notice of AGM will be transacted through voting by electronic means
- The remote e-voting period shall commence on September 26, 2022 at 09:00 A.M. (IST);
- The remote e-voting period shall end on September 28, 2022 at 05:00 P.M. (IST); The cut-off date for determining the eligibility to vote through remote e-voting / e-voting during the AGM is September 22, 2022 and a person who is not a Member as on the cut-off date should treat this Notice for information purposes only; 5. Any person who becomes member of the Company after dispatch of the Notice of the meeting and holding shares as of the cut-

off date i.e. September 22, 2022, may obtain the User ID and password by sending a request at email: beetalrta@gmail.com.

However, a person who is already registered with BEETAL Financial & Computer Services Pvt Ltd for e-voting then existing

User ID and password can be used to cast the vote. 6. Person, who acquires shares of the Company and become member of the Company after sending of the Notice of AGM and holding shares and eligible to vote, can follow the process for generating the login ID and password as provided in the Notice of the AGM. If such a person is already registered with CDSL for e-voting, existing user ID and password can be used for casting

7. Mr. Mohit Maheshwari, Partner or failing him Mr. Ankush Agarwal, Partner of M/s, MAKS & CO., Practicing Company

8. Members may note that: a) the remote e-voting module shall be disabled after the aforesaid date and time for voting and once

the vote on a resolution is casted by the member, the member shall not be allowed to change it subsequently; b) the members

Secretaries, has been appointed as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

who have casted their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; c) the facility for voting through electronic mode shall be made available at the AGM; and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. 9. If you have any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently

Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Rakesh Dalvi (022-23058542/43). Members, who are holding shares in physical form and their e-mail addresses are not registered with the Company/their respectiv Depository Participants, are requested to register their e-mail addresses at the earliest by sending scanned copy of a duly signed letter by the Member(s) mentioning their name, complete address, folio number, number of shares held with the Company along with selfted scanned copy of the PAN Card and self-attested scanned copy of any one of the following documents viz., Aadhaar Card, Driving License. Election Card. Passport, utility bill or any other Govt. document in support of the address proof of the Member as registered with the Company at askus@shalimarpaints.com for receiving the AGM Notice. Members holding shares in electronic/demat

orm can update their email address with their Depository Participants. The Notice of the AGM contains the instructions regarding the manner in which the shareholders can cast their vote through remote evoting or by e-voting at the time of AGM and join the AGM through VC / OAVM.

The AGM Notice and Annual Report is also available on the Company's website at www.shalimarpaints.com, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.nseindia.com, respectively, where the Company's shares are listed and on the website of Central Depository Services (India) Limited at www.cdslindia.com. Further, pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI Listing Regulations, the

Register of Members and Share Transfer Books of the Company will remain closed form Friday, September 23, 2022 to Thursday, September 29, 2022 (both days inclusive) for the purpose of AGM.

By order of the Board of Directors For Shalimar Paints Limited Shikha Rastogi **Company Secretary**

Date: 08.09.2022

Date: 08.09.2022

For ZENLABS ETHICA LIMITED